

ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રેદેશમાં વ્યાપારી ધોરણે કાગદી લીબુની જેતી થાય છે. ગુજરાતમાં મહેસાળા જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે. આ સિલાય આણંદ, ગાંધીનગર, ભાવનગર, સાબરકાંઠા તથા બનાસકાંઠા જિલ્લાઓમાં કાગદી લીબુની જેતી થાય છે.

લીબુનો પાક ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનો છે. અથાળાં, લીબુનો રસ, સ્કોશ (સરબતો) લીબુના છાલની ચટણી, લીબુના ફુલ, વિનેગાર, સૌદર્ય પ્રસાધન, સાખુ અને શેર્મ્પુ જેવા ઉદ્યોગોના વિકાસમાં આ પાકનો ફણો મુખ્ય છે. લીબુના ફણમાં વિટામીન-સી નું પ્રમાણ હોવાથી વાયુ, ઉધરસ, ઉલટી, શુણ અને પેટમાં ફૂભિનો નાશકરે છે.

લીબુનો રાજ્યના કુલ લીબુના વાવેતર વિસ્તારમાં ૪૨.૪ ટકા વિસ્તાર ઉત્તર ગુજરાતનો હોઈ આ વિસ્તારના એકૂતોને લીબુ પાકની વૈજ્ઞાનિક જેતી અંગેની માહિતી મળે તો એકમ વિસ્તારમાંથી વધારે ઉત્પાદન મેળવી શકે.

હવામાન :-

લીબુના પાકને શિયાળા તેમજ ઉનાળામાં સપ્રમાણ કંડી અને ગરમી પડતી હોય ત્યાં સારી રીતે ઉગાડી શકાય છે. તેમજ ચોમાસામાં બેનનું પ્રમાણ ઓછું હોય ત્યાં ઝાડનો વિકાસ સારો થાય છે.

ચોમાસામાં ગરમ અને બેનવાળા હવામાનને લીધે બળિયા ટપકાનો રોગ લાગુ પડે છે, તેમજ જીવાતનું પ્રમાણ પણ વધે છે. ઉત્તર ગુજરાતમાં ચોમાસામાં લાંબા સમય સુધી બેનવાળું વાતાવરણ રહેતું ન હોવાથી લીબુની જેતી માટે સૌથી અનુકૂળ વિસ્તાર છે.

આ પાકના મૂળ છીછરા હોવાથી જમીનની નિતારશક્તિ અને બેન ધારણ શક્તિ સારી હોય, ૧.૫ થી ૨ મી. સુધી ઉંડાઈ ધરાવતી હોય તેવી જમીનમાં સફળતા પૂર્વક ઉગાડી શકાય છે. જમીનમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ઉપરાંત જસત અને લોહ તત્વ પુરતા પ્રમાણમાં હોય તેવી ફણકૃપ જમીનમાં પાક સારો થાય છે.

સુધારેલી જાતનો :-

લીબુ પર્ગની બે જાતો છે. (૧) કાગદી લીબુ અને (૨) રંગપુર લીબુ

કાગદી લીબુમાં રસનું પ્રમાણ વધારે હોવાથી તેમજ ફણની છાલ પાતળી હોવાથી ઉત્તર ગુજરાત માટે વધારે અનુકૂળ છે.

કાગદી લીબુના રોપાઓના ઉછેર :-

લીબુ એક ખાદ્ય બ્રૂઝીય પ્રભાતિ છે, બીજમાંથી તૈયાર થયેલ રોપા માતૃષ્ઠોડ જેવા ગુણધર્મો ધરાવે છે. આથી કાગદી લીબુની જેતી માટે બીજમાંથી તૈયાર કરેલા રોપાઓના ઉપયોગ કરવાની ભલામણ છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી તૈયાર કરેલા રોપાઓ લાંબુ આખુષ્ય ધરાવે છે અને વધુ ઉત્પાદન આપે છે. સરકારી, અર્ધસરકારી કે સરકાર માન્ય નર્સરીઓમાંથી જરૂરિયાત મુજબના રોપાઓ મેળવીને વાવેતર કરવું જોઈએ.

બીજ માટે ફણ અને ઝાડની પસંદગી :-

ને છોડ ઉપર નિયમિત વધુ ફણ બેસતા હોય, ફણો લંબગોળ અને પાતળી છાલ ધરાવતા હોય, રોગ-જીવાતથી મુક્ત હોય તેવા ઝાડના ફણમાંથી બીજ એકત્ર કરવા. ચોમાસામાં ફણનું ઉત્પાદન વધારે હોય છે અને બજારભાવ ઓછો મળતો હોય છે. આથી ચોમાસા દરમ્યાન બીજ એકત્ર કરવા, આર્થિક દ્રષ્ટિએ હિતાવહ છે.

અંદાજે ત૦ થી ૪૦ ફળનું વજન એક કિલો ગ્રામ હોય છે. એક ફળમાં ૮ થી ૧૦ બીજ હોય છે. એક કિલો ગ્રામ બીજમાં અંદાજે ત૩૦,૦૦૦ બીજ હોય છે. બીજને પાણીમાં નાખતા ડુબી જાય તેવા ભરાવદાર બીજ પસંદ કરવા. ફળમાંથી બીજ કાઢી લીધા પછી જેમ બને તેમ વહેલા બીજની વાવણી કરવી. ૨૦ દિવસથી વધુ સમય સુકવવાથી બીજની ઉગવાની શક્તિમાં ઘટાડો થાય છે. બીજનો સંગ્રહ કરવાની જરૂર પેટ તો બીજને રાખ સાથે લેળવી છાંચામાં સુકવવા. રોપાઓનો ઉછેર કરવા માટે નર્સરીમાં ૧ મી \times ૨ મી ના માપના રેતાળ/ગોરાડું જમીનમાં સપાટ ક્યારા બનાવવા. દરેક ક્યારામાં ૪ થી ૫ કિ.ગ્રા. સાક્ષ કહોવાયેલું છાણીયું ખાતર લેળવવું. જમીનમાં ઉધર્ણનો ઉપદ્રવ હોય તો મીથાઈલ પેરાથી ઓન ૨ ટકા લુકી દરેક ક્યારામાં ૫૦ ગ્રામ પ્રમાણે લેળવવી, જમીનમાં કૂમિનો ઉપદ્રવ હોય તો ૫ ગ્રામ કાર્બોફ્લેયુરન દાણાદાર દવા દરેક ક્યારામાં લેળવવી.

બીજને ક્યારામાં વાવતાં પહેલા કુગજન્ય દવાઓ ને વીકે કેપ્ટાન, સેરેશાન, થાયરમ પૈકી ગમે તે એક દવાનો (એક કિ.ગ્રામ બીજ માટે તૃઘામ દવા) પટ આપવો.

બીજને નર્સરી ક્યારામાં બે હાર વર્ચ્યે ૧૫ સે.મી. અને દરેક હારમાં બે બીજ વર્ચ્યે ૫ સે.મી.નું અંતર રહે તે રીતે ૨ સે.મી. ઉંચાઈએ જુલાઈ-ઓગષ માસમાં વાવવા. વાવણી પછી તુર્ટજ કુવારાથી પાણી આપવું. શિયાળામાં ૬ થી ૮ દિવસે અને ઉનાળામાં ૪ થી ૬ દિવસે ઘડ્ઝવાડિયામાં પિયત આપવું. જરૂરીયાત મુજબ ગોડ કરવો. રોગ અને જીવત સામે યોગ્ય પગલાં લેવા. વર્ષમાં બે વખત બોડોમિશ્રણ અથવા તાંબાયુક્ત દવાનો છંટકાવ કરવો.

રોપાઓ એક વર્ષના થાય ત્યાર પછી બીજ ઘડ્ઝવાડિયામાં ફેરવવા, જેથી છોડના વિકાસ માટે પુરતા પ્રમાણમાં સુર્ય પ્રકાશ, હવા, પાણી અને પોષક તત્ત્વો મળી રહે. આ સમયે નબળા છોડ, મુખ્ય થડ અને મુળ આગળથી વળી ગયેલા તેમજ રોગીએ છોડ કાઢી નાખવા. રોપાની ૧૫ થી ૨૦ સે.મી. ઉંચાઈ સુધી થડ ઉપરથી ડાળીઓ કાપી નાખવી આમ પસંદગી કરેલા રોપાઓને બે હાર વર્ચ્યે ૩૦ સે.મી. અને બે છોડ વર્ચ્યે ૧૫ સે.મી. અંતર રાખી રોપવા. જે વર્ષની ઉંમરના આશરે ૬૦ સે.મી. ઉંચાઈના અને વધારે તંતુ મૂળવાળા રોપા રોપણી માટે ઉત્તમ ગણાય છે.

રોપણી અંતર અને પદ્ધતિ:-

લીંબુની રોપણી ૬ મીટર \times ૬ મીટરના અંતરે કરવામાં આવે છે. જે ખેતરમાં લીંબુનો પાક લેવાનો હોય તે ખેતરમાં ઉનાળા દરમ્યાન એક-બે ઉંડી એડ કરી સમાર મારી જમીન સમતલ કરવી. ત્યારબાદ ભલામણ કરેલ અંતરે જ્યાં છોડ વાવવાનો થતો હોય ત્યાં ૬૦ સે.મી. \times ૬૦ સે.મી. \times ૬૦ સે.મી.ના માપના ખાડા ખોદવા. ખાડા ખોદતી વખતે ખાડાના ઉપરના અડધા ભાગની માટી તેમજ નીચેના અડધા ભાગની માટી અલગ રાખવી. ખાડાને ૧૫ થી ૨૦ દિવસ સૂર્યના તાપમાં તપવા દેવા. ત્યાર બાદ ખાડાના ઉપરના અડધા ભાગની માટી સાથે સાક્ષ કહોવાયેલું ૨૦ કિ.ગ્રા. છાણીયું ખાતર તેમજ ૨૦૦ ગ્રામ ડિ.એ.પી. ખાતર લેળવી ખાડા ભરવા. ઉધર્ણ, કૂમિ, રોગ તેમજ જીવતના નિયંત્રણ માટે સાવચેતીના પગલા રૂપે ઉપર મુજબની ભલામણ કરેલ જરૂરી દવાઓ ખાડામાં લેળવવી.

રોપણી :-

ચોમાસા દરમ્યાન એકાદ બે સારા વરસાદ થયા પછી તંદુરસ્ત અને જુસ્સાદાર રોપાઓની પસંદગી કરી, ખાડાના મધ્ય ભાગમાં આજું બાજુની જમીનની લેવલ કરતાં ૩૦ સે.મી. નીચે રોપણી

કરવી. જેથી ચોમાસામાં વરસાદનું પાણી થડની આજુ બાજુ જમા થઈ શકે. રોપણી પછી છોડની આજુ બાજુની જમીન બરાબર દ્વારાવી જેથી અંદર હવાનું પોલાણ રહે નહિ. રોપણી પછી તુર્તજ પાણી આપવું. પવન અને ભારે વરસાદમાં છોડ પડી ન જય તે માટે છોડનેટેકો આપવો.

ખાતર:-

એક અંદાજ મુજબ જો લીંબુના છોડ વર્ષે ૩૦ ટન/હેક્ટાર ઉત્પાદન આપે તો તે જમીનમાંથી વર્ષ દરમ્યાન કુલ ૨૭૦ કિ.ગ્રામ નાઇટ્રોજન, ૬૦ કિ.ગ્રામ. ફોસ્ફરસ અને ૩૫૦ કિ.ગ્રામ પોટાશ જેવા મુખ્ય પોષક તત્વોનો ઉપાડ કરે. કાગદી લીંબુમાં બારેમાસ ફળ મળે છે. આથી છોડની વૃધ્ઘિ અને વિકાસ સારો થાય અને ઉત્પાદન વધારે મળે તે માટે પાકને નિયમિત પુરતા પ્રમાણમાં અને સમયસર ખાતરો આપવાની ખાસ જરૂરી છે.

સામાન્ય રીતે ફળપાકને ખાતરો જાડના થડથી દૂર, જાડના ઘેરાવાના નીજા ભાગને છોડી દઈને બાકીના ઘેરાવામાં જમીનમાં રીતું બનાવી દાટી દેવા. જાડ જેમ વધતું જય તેમ રીતું મોટી બનાવતા જરૂરું.

આ ઉપરાંત લીંબુના પાકને જસત અને લોહ તત્વની જરૂર પડે છે. જસત અને લોહ તત્વની ઉષાપને લીધે પાણ પીળા પડી જય છે. પાણનો આકાર ઢુકો થઈ જય છે, છોડના વિકાસની ગતિ ધીમી પડે છે. આ ઉષાપ દૂર કરવા જયારે છોડને નવા પાણ કુટા હોય ત્યારે ૧૦૦ લીટર પાણીમાં ૫૦૦ ગ્રામ ઝીક સલ્ફેટ અને ૫૦૦-૭૫૦ ગ્રામ ફેરસ સલ્ફેટનું દ્રાવણ તૈયાર કરી તેમાં ૫૦૦ ગ્રામ ઓગજેલ ચુનામાંથી ૧૦ લીટર નિર્યાપ પાણી મેળવીને ર થી ત છંટકાવ કરવા. આ સિવાય જમીનમાં છોડને ફરતા થડથી ૫૦ સે.મી. દૂર ચાસમાં ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ ૫૦-૭૫ ગ્રામ ઝીક સલ્ફેટ અને ૧૦ કિગ્રા છાણીયું ખાતર ભેણવીને છોડની ફરતે આપવાથી ઉષાપ નીતારી શકાય છે.

પિયત:-

લીંબુના મુળ છીછરા હોવાથી લાંબા દિવસના અંતરે ભારે પાણી આપવા ને બદલે ઓછા દિવસના અંતરે હળવું પાણી આપવાની ખાસ ભલામણ છે.

શક્યાત્માં રોપણી બાદ તુર્તજ પાણી આપવું. ઉછરતા જાડને ચોમાસામાં વરસાદ ન હોય તો ત થી ૪ દિવસના અંતરે, શિયાળામાં ઇ થી ૭ દિવસના અંતરે અને ઉનાળામાં ૪ થી ૬ દિવસના અંતરે પાણી આપવું. પુખ્ત વયના જાડને જમીનના પ્રકાર, કંતુ મુજબ બે પિયત વચ્ચેનો ગાળો અનુભવને ધ્યાનમાં રાખી નાનો મોટો કરવો, પરંતુ સામાન્યપણે શિયાળામાં ૧૦ થી ૧૨ દિવસના અને ઉનાળામાં ૭ દિવસના અંતરે પાણી આપવું. (૨૫ક સિંચાઈ બેસાડેલ હોય તો જમીન, કંતુ અને છોડના વિકાસને ધ્યાનમાં લઈ રોજનું ૩૦ થી ૫૦ લિટર પાણી મળી રહે તેવી ગોઠવણ કરવી. પાણી જાડના થડને અડકે નહિ તે રીતે આપવું જેથી ગુંદરીઓ રોગ લાગુ પડવાની શક્યતા ઓછી રહે.

લીંબુના પુખ્ત વયના છોડમાં ૨૫ક સિંચાઈ દ્વારા પિયત આપવામાં આવે તો ૬૩ લિટર પાણીનો બચાવ થાય છે. આ પદ્ધતિમાં છોડ દીઠ ૪ લીપર રાખી જન્યુઆરીમાં ૨ કલાક, ફેલ્બુઆરીમાં-૩ કલાક, માર્ચમાં-૪ કલાક, એપ્રિલથી જુનમાં ૫ કલાક, જુલાઈથી સપ્ટેમ્બર થી ડિસેમ્બરમાં-૩ કલાક ચલાવવાની ભલામણ કરવામાં આવી છે.

કેળવણી અને છાંટણી:-

કાગદી લીંબુના થડ ઉપર અનેક ડાળીઓ કુટતી હોય છે. પરંતુ જાડનો વિકાસ એક જ થડ

પર થાય તે ખાસ જરૂરી છે. રોપણી પછી પ્રથમ વર્ષથી જ જમીન થી ૪૫ સે.મી. સુધીમાં મુખ્ય થડ ઉપર એક પણ ડાળી કુરવા દેવી જોઈએ નહીં. ત્યારબાદ દરેક દિશામાં છોડ દીઠ ચાર થી પાંચ ડાળીઓ રાખવી જેથી છોડનો ચારેખાજુ એક સરખો વિકાસ થાય જેથી જેતી કર્યો કરવામાં સરળતા રહે. ભવિષ્યમાં પણ મુખ્ય થડ ઉપર નીકળતા પાણી પીલા (નવીન કુટ) સતત દૂર કરતા રહેનું. આ ઉપરાંત ચોમાસુ પુરુ થતાં દર વર્ષે સુકી, રોગિએ અને નુકશાનવાળી ડાળીઓ કાપીને દૂર કરવી અને ખુલ્લા થયેલ ભાગ ઉપર બોડોપેસ્ટ બનાવી તુરત જ લગાડવી.

આંતરપાક :-

લીંબુની નવી વાડીમાં શરૂઆતના ત્રણ થી ચાર વર્ષ સુધી આંતરપાક તરીકી શાકભાજુ પાકો જેવાં રીંગાજ, મરચી, ટામેટા, કુંગળી, ગુવાર જેવા પાકો લઈ શકાય છે.

બહારની માવજત :-

લીંબુના પાકમાં જે કોઈ ખાસ સમયે વિશેષ માવજત આપવામાં ન આવે તો આખા વર્ષ દરમ્યાન ઓછા વાતા પ્રમાણમાં કુલો અને ફળો મળ્યા કરે છે. સામાન્ય રીતે ફેલુઅારી માસમાં આવતા કુલોના ફળ જુલાઈ-ઓગષ્ટ માસમાં મળે છે. જે વર્ષના કુલ ઉત્પાદનનો આશરે ૬૦ ટકા હિસ્સો થવા જાય છે. ત્યાર પછી જુન-જુલાઈ માસમાં આવતા કુલોમાંથી ઓક્ટોબર-નવેમ્બર માસમાં ફળ મળે છે. જે વર્ષના કુલ ઉત્પાદનના ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે ઓક્ટોબર-નવેમ્બરમાં આવેલા કુલોમાંથી એપ્રિલ-મે માસમાં ફળો મળે છે, જે ૧૦ ટકા હિસ્સો થવા જાય છે.

આમ બજારમાં લીંબુની માંગ અને ભાવ જેવા જોઈએ તો ઉનાણા દરમ્યાન વધારે હોય છે ત્યારે લીંબુ ઓછા મળે છે. આની સામે ચોમાસામાં ઉત્પાદન પુષ્કળ મળે છે જ્યારે બજાર ભાવો ઓછા મળે છે. આ સંલોગોમાં લીંબુના પાકના કુલ આવવાના સમયમાં ફેરફાર કરવામાં આવે અને ઉનાણામાં વધારે ઉત્પાદન મેળવી શકાય તો લીંબુની જેતી વધારે નફકારક બનાવી શકાય.

આ પરિસ્થિતિ નિર્માણ કરવા માટે ચોમાસા પછી વાડીને જેડી, ગોડ કરી જ જમીનને ૨૦ દિવસ સુધી તપવા દેવી. સૂક્કી અને રોગિએ ડાળીઓ કાપી નાખવી અને તેના ઉપર બોડોમિશ્રણનો છંટકાવ કરયો. ૨૦ દિવસ પછી લલામણ પ્રમાણે ખાતરો આપી પિયત આપવું જેથી કુલો આવવાની શરૂઆત થશે. ઘણી વખત આવી માવજત આપવાથી છોડની વાનર્સપ્ટિક વૃદ્ધિ થવાથી કુલો આવતા નથી. ઘણી વખત પાછોતરો વરસાદ થવાથી જ જમીનમાં વધારે બેજના કારણે છોડના વાનર્સપ્ટિક વિકાસ થવાથી કુલો આવતા નથી. આ સંલોગોમાં ૧૦ પી.પી. એમ, ૨-૪-ડી અથવા ૫૦ પી.પી. એમ નેથેલિક એસિટિક એસિડનો ૧ ટકાના યુરિયાના દ્રાવણ સાથે છંટકાવ કરવાથી પણ કુલો વહેલા મેળવી શકાય છે. ૨ ટકાના યુરિયાના દ્રાવણની સાથે ૨૦ પી.પી. એમ નેથેલિક એસિટિક એસિડના એક-બે છંટકાવ કરવાથી ફળ ખરતા અટકે છે અને લીંબુના ફળના કદમાં અને વજનમાં વધારો થાય છે. સારેમધર થી નવેમ્બર માસની વરચે ૨૦ પી.પી. એમ. ૨-૪ ડી ના ત્રણ છંટકાવ કરવાથી પણ ફળનું ખરણ અટકે છે.

કણોનું ફાટવું :- પાણીની અનિયમિતતા અને બોરોન તત્ત્વની ઉણાપ

ઉપાય :-

નિયમિત પાણી આપવું. ૧૦ લિટર પાણીમાં ૨૦ ગ્રામ બોરેક્સ પાવડર નાખી બનાવેલ દ્રાવણનો છંટકાવ કરયો.

લીંબુની મુખ્ય જીવાતો :-

(૧) લીંબુની હગારીયા ઈયળ (લીંબુનું પતંગીયું) :-

આ જીવાતનું પુષ્ટ કાળા રંગનું સફેદ પતંગીયું છે જેની આગળની પાંખો પીળા ટપકાંવાળી, પાછળની પાંખો ઉપર પાછળની ધારે ઢેખાળીયા રંગનો અંડાકાર ડાઢો અને પાછળના ભાગમાં પૂછી જેવા આકાર હોય છે. નાની ઈયળ કાળાશ પડતા ભુરા રંગની અને સફેદ રંગની આડી અવળી લીટીવાળી દેખાય છે. ઈયળ પક્ષીની હગાર જેવી હોય છે તેથી અને હગારીયા ઈયળ જુહે છે. પુષ્ટ ઈયળ ધારા રંગની હોય છે. ઈયળ કુમળા પાનને મુખ્ય નસ સુધી ખાઈ જાંખરા જેવું બજાવી દે છે. નર્સરીમાં ઉપક્રમ વધુ હોય તો રોપાનો વિકાસ અટકી જાય છે.

નિયંત્રણા :-

- * વાડીમાં બેઝી એન્ડ વચ્ચે પુરતું અંતર રાખવું તથા પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવું.
- * ઈયળનો ઉપક્રમ ધરુવાઈયાકે નવા રોપામાં થયો હોય તો મોટી ઈયળ/કોશોટા હાથથી વીજી નાશ કરવો.
- * વાડીની આજુભાજુના વિસ્તારમાં વાડમાં ગળો અને વાસણવેલના વેલા હોય તો નાશ કરવો. * આ ઈયળનો ઉપક્રમ વધુ હોય તો લીંબોળીની તેલચુક્ત દવા ૫૦ મી.લી. પ્રોફેનોફોસ ૨૦ મી.લી./મોનોકોટોફોસ ૧૦ મી.લી. દવા ૧૦ લી. પાણીમાં બેળવી છંટકાવ કરવો તથા ગળો અને વાસણવેલના વેલા પર પણ છંટકાવ કરવો.

(૨) લીંબુનું પાન કોરીયું :-

આ ઈયળ લીંબુના કુમળા પાનમાંથી હરિતકણો (લીલો ભાગ) સર્પાકારે કોરી ખાય છે જેથી પાન પર સફેદ (સીલ્વર) રંગની વાંકીચૂકી લીટીઓ પડે છે જેથી પાન કોકડાઈ તથા સુકાઈને નીચે પડી જાય છે.

નિયંત્રણા :-

પાનકોરીયાના નિયંત્રણ માટે જ્યારે નવી કૂટ શરૂ થાય અને ૧૫ સે.મી.ના ટૂંખ પર ૧ ઈયળ જેવા મળે ત્યારે નિકોટીન સલ્ફેટ ૪૦ ટકા ૨૫ મીલી/૧૦ લી. અથવા ડાયમિથોએટ ૦.૦૩% (૧૦ મી.લી./૧૦ લી.) અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૦.૦૨૫% (૧૦ મી.લી./૧૦ લી.પાણી) અથવા લીંબોળીના મીજના ૫ ટકા ક્રાવણના ત થી ૪ છંટકાવ કરવા.

(૩) સાયટ્રેસ સાયલા અને લીંબુનું હગારીયા ઈયળ પતંગીયું :-

આછા રંગના બચ્ચાં તથા પુષ્ટ કીટકો નવી કૂટેલી કુંપળોમાંથી રસ ચૂસે છે. જેથી કુંપળોની વૃદ્ધિ અટકે છે.

નિયંત્રણા :- લીંબુના પાનકોરીયામાં જણાવેલ દવાઓનો છંટકાવ કરવો.

લીંબુના રોગો :-

(૧) બળિયા ટપકા (શીતળા) :-

લીંબુના પાકમાં આવતો બળિયા ટપકાનો રોગ મુખ્ય છે તે જીવાળાથી થાય છે. જેમાં પાન, ડાળીયો તથા ફળ પર કથથાઈ રંગના ખરબચડા ટપકાં પડે છે જેથી ફળના ખજાર ભાવ ઓછા મળે છે.

૧) વાડીની સ્વચ્છતા જણવવી

- ચોમાસું પુરુ થયા પછી તેમજ લીંબુ ઉતારી લીધા બાદ રોગિએ ડાળીઓ કાપી એકઠી કરી બાળી નાખવી.
- ડાળીઓ કાણ્યા બાદ કોપર એકઝીકલોરાઈડ ગ્રુપની કોઈપણ એક દવા (બ્લાઇટોક્ષ-૫૦ અથવા બલ્યુ કોપર-૫૦) ૪૦ ગ્રામ/૧૦ લીટર પાણીમાં ભેળવી અથવા ૧% બોર્ડ મિશ્રણ બનાવી પ્રથમ છંટકાવ જાડના દરેક ભાગ પર દવા પડે તે રીતે છંટકાવ કરવો. આ દવાનો બીજો છંટકાવ ફેબુઆરી-માર્ચ, ત્રીજો છંટકાવ જૂન મહિનામાં પ્રથમ પખવાડીયામાં ચોથો છંટકાવ જુલાઈ-ઓગષ્ટ માસમાં વરસાદ વાળું વાતાવરણ હોય ત્યારે કરવો.
- સ્ટ્રેટ્ઝોમાયસીન સલફેટ ૧ ગ્રામ અને ૪૦ ગ્રામ કોપર ઓકઝીકલોરાઈડ ૧૦ લીટર પાણીમાં મિશ્રકરી જુન-ઓગષ્ટ તથા ડિસેમ્બર મહિનામાં છંટકાવકરવો.

(૨) ગુંદરીયો:-

કુગથી થતા આ રોગમાં થડ તથા ડાળીઓ પર ગુંદર જેવો ચીકણો પદાર્થ જરે છે. ડાળી પર તિરડો પડે છે અને જાડ ચીમળાઈને સુકાવવા માટે છે. લીંબુના ફળ પાકતા પહેલા પીળા પડીને ખરી પડે છે.

- વાડીની સ્વચ્છ લાળવવી તથા જમીનની નિતાર શક્તિ વધારવી.
- જમીનને અડકતી ડાળીઓ છાટણી કરી બાળી નાખવી.
- થડ પર બોર્ડોપેસ્ટ લગાવવી માટી થડની ફરતે ચઢાવવી જેથી પાણીનો સીધો સંપર્ક થડ સાથે થાય નહીં.
- દર વર્ષે જાડના થડ પર ૪૫ સે.મી. સુધી બોર્ડોપેસ્ટ લગાડવું.

૫) ડાળી અને થડ ઉપર જે જગ્યાએ ગુંદર જગ્યાય તેવા રોગિએ હોડની ફરતે એકાદ ઈંચ જેટલી ડાળી કે થડની છાલ ચાપ્યું કે દાતરડી વડે કાળજી પૂર્વક છોલી એકઠી કરી ખેતરની બહાર બાળી નાખવી અને તેના પર બોર્ડોપેસ્ટ લગાવવું (બોર્ડોપેસ્ટ બનાવવા માટે ૧ કિગ્રા મોરથુથુ અને ૧.૫ કિ.ગ્રા. ચૂનો, માટી અથવા સિમેન્ટના પ્લાસ્ટિકના અલગ અલગ વાસણામાં ૧૦ લીટર પાણીમાં ભેળવીને બનાવવું.)

(૩) સુકારો:-

આ રોગમાં ટોચથી નીચેની તરફ ડાળીઓ સુકાતી જાય છે. આવા જાડના મૂળ પણ ખવાઈ ગયેલા નેવા મળે છે. અને આ જાડ જ થી ૮ માસમાં સાંપૂર્ણ સુકાઈ જાય છે. આ રોગ અનેક પ્રકારના કારણોને લીધે થાય છે. તેથી નિયંત્રણ કરવું મુશ્કેલ છે. સુકારાને અટકાવવા માટે.

- * જમીનની યોગ્ય પસંદગી કરવી.
- * રાસાયણિક ખાતરો, સેન્ટ્રીય ખાતરો અને ગૌણ તત્વોનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો.
- * વાડીની સ્વચ્છતા લાળવવી.
- * રોગિએ ડાળીઓને કાપી બાળીને નાશ કરવી.
- * ખેતીકાર્યો કરતી વખતે જાડને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખવું.
- * જાડના ફરતે ગોડ કરવો.
- * રોગ અને જીવાતનું શરૂઆતથી જ અસરકારક નિયંત્રણ કરવું.



ગંઠવા કુમિ :-

કુમિથી થતા આ રોગનું પ્રમાણ ઉત્તર ગુજરાતની રેતાળ અને ગોરાડુ જમીનમાં વધારે જોવા મળે છે. કુમિ લાગવાથી ઝાડનો વિકાસ અટકી જાય છે અને ધીમે ધીમે પાન ચીમળાઈ જાય છે જેથી પુરતા પ્રમાણમાં પાણી અને ખોરાક મળતો ના હોય તેવા ચિહ્નનો જણાય છે. ઝાણીઓ અને પાન સુકાઈ જાય છે અને ધીમે ધીમે ઝાડ પણ સુકાઈ જાય છે. રોગિએ છોડના મૂળને ખોડીને જોતા મુળ ઉપર અસર્ખ નાની મોટી ગાંઠો જોવા મળે છે.

કુમિ નિયંત્રણ :-

- (૧) ઘડવાડીયામાં સોઈલ સોલરાઈઝેશન અથવા રાબીંગ કરવું.
- (૨) ઘડવાડીયામાં કાર્બોફિયુરાન (ફિયુરાડાન ડે લુ દાણાદાર) દવા પ કિગ્રા આપવાથી કુમિનું નિયંત્રણ અસરકારક રીતે કરી શકાય છે.
- (૩) કોઈપણ પાક લીધા પછી ઉનાણમાં બે થી ત્રણ વાર હેક્ટરની ઉંડી એડ કરવી જેથી જમીન તપે અને બીજા વર્ષે કુમિનો ઉપદ્રવ ઘટાડી શકાય.
- (૪) રોગયુક્ત ઘડનો ઉપયોગ કરવો નહીં, નહીં તો જે એતરમાં કુમિ ના હોય તેમાં કુમિનો ફેલાવો થશે.
- (૫) પાકની ફેરબદલી કરવી. જો ગંઠવા કુમિનો એતરમાં ઉપદ્રવ હોય તો પાકની ફેરબદલી ધાન્યપાકો સાથે કરવી.
- (૬) એતરમાં શાંખનો લીલો પડવાશ કરવો.
- (૭) સેન્ટ્રિય ખાતરો જેવાં કે પ્રેસમેડ, મરધાનું ખાતર, છાણિયું ખાતર ૧૦ ટન/હેક્ટરે અથવા જુદા જુદા ખોળ જેવાં કે દિવેલીનો ખાળ, લીમાણનો ખોળ ૧ થી ૨ ટન/હેક્ટરે જમીનમાં વાવવાના દસ દિવસ અગાઉ આપવો.
- (૮) બૈવિક નિયંત્રક પેસીલોમાઈસીસ લીલાસીનસ (કફ્યલશાહશાળુભયત હશહક્ફભશક્તિ) ગંઠવા કુમિના નિયંત્રણ માટે ૨.૫ કિગ્રા પ્રતિ હેક્ટર મુજબ છાણીયા ખાતર સાથે ૧૫ દિવસ સમૃદ્ધ કરી થડની ફરતે આપવું.

મોટલ લીફ (પીળીયો) :-

આ રોગ જસત ગૌણ તત્વની ઉણપના કારણો થાય છે. આ રોગની શરૂઆત ઝાડના ટોચના ભાગથી થાય છે. પાનની નસો લીલી રહે છે પરંતુ વચ્ચેનો ભાગ પીળો પડી જાય છે. ટોચના પાન નાના થઈ જાય છે. ફણનો વિકાસ થતો નથી જેથી ફણ કદમાં નાના, પીળા અને તીવ્ર ઉણાપ હોય તો વિકૃત આકારના થઈ જાય છે.

નિયંત્રણ :-

- (૧) ૧૦ લીટર પાણીમાં ૫૦ ગ્રામ જીક્સ સલેટ મિશ્ર કરી એક માસના અંતરે ત્રણ વખત છંટકાવ કરવો.
 - (૨) નવા પાન આવે ત્યારે જસત અને ચૂનાના મિશ્રણનો મહિને બે મહિને પાન પર છંટકાવ કરવો.
- ઉત્પાદન :-** સામાન્ય રીતે કાગદી લીલુભુમાં રોપણી પછી ત્રીજા કે ચોથા વર્ષે ફણ મળવાની શરૂઆત થાય છે. સારી માવની કરેલ વાડીમાં સરેરાશ પ૦ થી ૧૦૦ કિગ્રા/ઝાડ જેટલું ઉત્પાદન મળે છે અને હેક્ટરે ૨૦ ટન જેટલું ઉત્પાદન મળે છે.